

Extra No. 181



सत्यमेव जयते

# The Gujarat Government Gazette

EXTRAORDINARY  
PUBLISHED BY AUTHORITY

Vol. LXIV ] THURSDAY, MAY 4, 2023 / VAISHAKHA 14, 1945

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than  
those published in other parts.

वैधानिक अने संसदीय बाबतोनो विभाग

सचिवालय, गांधीनगर, જથી મે, ૨૦૨૩

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના તારીખ: ૩૧મી માર્ચ, ૨૦૨૩ના જાહેરનામા ક્રમાંક: જીડબલ્યુસી-૨૦૨૩ (૧)-આઈસીડી-૧૦૨૦૧૩-૧૬૪૨-બી. નો ગુજરાતી અનુવાદ આથી સર્વે લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,  
સરકારના નાયબ સચિવ.

**NOTIFICATION****Regarding****Amendment to the Programme Officer/Assistant Director, Class I, in the General State Service, under the Commissionerate of Women and Child Development, Recruitment Rules, 2016**

મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, કાર્યક્રમ (પ્રોગ્રામ) અધિકારી/મદદનીશ નિયામક, વર્ગ ૧, ભરતી નિયમો, ૨૦૧૬ સુધારવા સંબંધી

જાહેરનામું

મહિલા અને બાળ વિકાસ વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૩૧મી માર્ચ, ૨૦૨૩

**ક્રમાંક:** જીડબલ્યુસી-૨૦૨૩ (૧)-આઈસીડી-૧૦૨૦૧૩-૧૬૪૨-બી:- ભારતના સંવિધાનના અનુચ્છેદ ૩૦૮ના પરંતુકથી મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, કાર્યક્રમ (પ્રોગ્રામ) અધિકારી/મદદનીશ નિયામક, વર્ગ ૧, ભરતી નિયમો, ૨૦૧૬ વધુ સુધારવા નીચેના નિયમો કરે છે:-

૧. મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, કાર્યક્રમ (પ્રોગ્રામ) અધિકારી/મદદનીશ નિયામક, વર્ગ ૧, ભરતી (સુધારા) નિયમો, ૨૦૨૩ કહેવાશે.
૨. મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, કાર્યક્રમ (પ્રોગ્રામ) અધિકારી/મદદનીશ નિયામક, વર્ગ ૧, ભરતી નિયમો, ૨૦૧૬ “(જેનો આમાં હવે પછી “સદરહુ નિયમો” તરીકે ઉલ્લેખ કર્યો છે તે)માં, નિયમ ૨-માં, ખંડ (ક)માં,”  
(૧) “સિદ્ધ ગુણવત્તા અને કાર્યદક્ષતાવાળી વ્યક્તિની બઢતીથી કરવી જોઈશે” એ શબ્દોને બદલે, “ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણે, બઢતી માટે યોગ્ય ગણાવા માટે વિચારણાના ક્ષેત્રની અંદર “સારા” નો આધારચિહ્ન (બેન્યમાર્ક) ધરાવતી વ્યક્તિની બઢતીથી કરવી જોઈશે” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા;  
(૨) પેટા-ખંડ (૧)માં, “ગુજરાત સંકલિત બાળ વિકાસ સેવામાં” એ શબ્દોને બદલે, “સામાન્ય રાજ્ય સેવામાં” એ શબ્દો મૂકવા;
૩. સદરહુ નિયમોમાં, નિયમ ૩-ને બદલે, નીચેનો નિયમ મૂકવો:-  
“૩. બઢતીથી અને સીધી પસંદગીથી કરવાની નિમણૂકો ૩:૧ના પ્રમાણમાં કરવામાં આવશે.”.
૪. સદરહુ નિયમોમાં, નિયમ ૪-માં, પેટા-નિયમ (ખ)માં,  
૧. ખંડ (૧)માં, પેટા-ખંડ (૨)ને બદલે, નીચેનો પેટા-ખંડ મૂકવો:-  
“(૨) સરકારે માન્ય કરેલી મુખ્ય સેવિકા, વર્ગ ૩-ના દરજ્જાથી ઉતરતા દરજ્જાની ન હોય તે જગાને સમકક્ષ જગા ગણી શકાય તેવી જગા પરનો, સરકાર/સ્થાનિક મંડળો/સરકારી અન્ડરટેકિંગ/બોર્ડ/કોર્પોરેશન/કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ સ્થપાયેલી લિમિટેડ કંપની/યુનિવર્સિટી/રજિસ્ટર થયેલ બિન-સરકારી સંગઠનમાં સંકલિત બાળ વિકાસ/બાળ આરોગ્ય/પોષણ/આરોગ્ય શિક્ષણના ક્ષેત્રમાંનો આશરે ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈશે; અથવા”;
૨. ખંડ (૨)માં, પેટા-ખંડ (૨)ને બદલે, નીચેનો પેટા-ખંડ મૂકવો:-  
“(૨) સરકારે માન્ય કરેલી મુખ્ય સેવિકા, વર્ગ ૩-ના દરજ્જાથી ઉતરતા દરજ્જાની ન હોય તે જગાને સમકક્ષ જગા ગણી શકાય તેવી જગા પરનો, સરકાર/સ્થાનિક મંડળો/સરકારી અન્ડરટેકિંગ/ બોર્ડ/કોર્પોરેશન/કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ સ્થપાયેલી લિમિટેડ કંપની/યુનિવર્સિટી/રજિસ્ટર થયેલ બિન-સરકારી સંગઠનમાં સંકલિત બાળ વિકાસ/બાળ આરોગ્ય/પોષણ/આરોગ્ય શિક્ષણના ક્ષેત્રમાંનો આશરે પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈશે; અથવા”;

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

જે. આઈ. લેઉવા,  
સરકારના ઉપસચિવ.

